

RAN-2301001201030571 / 2601006501030306
B.A. (NEP) (Sem. I) Examination April - 2026
Minor-I Economics-I : Micro Economics
Time: 2 Hours]
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) જમણી બાજુ પ્રશ્નોના ગુણ દર્શાવવામાં આવ્યા છે. The question marks are shown on the right. (3) બધાજ પ્રશ્નો ફરજિયાત છે. All questions are mandatory.	Seat No.: Student's Signature
---	---

- પ્ર. 1 નીચેના પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપો. (કોઈ પણ પાંચ) (10)**
1. એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો.
 2. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું?
 3. માંગ વિધેય એટલે શું ?
 4. મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર જણાવો.
 5. બજેટ રેખાનો અર્થ સમજાવો.
 6. તૃષ્ટિગુણ વિશ્લેષણની મર્યાદાઓ જણાવો.
 7. ઉત્પાદનનો અર્થ આપો.
- પ્ર. 2 સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ આપી. તેના કાર્યક્ષેત્ર, મહત્વ અને મર્યાદાઓ વિષે વિસ્તારથી ચર્ચા કરો. (13)**
- અથવા**
- પ્ર. 2 (અ) માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો સમજાવો. (06)**
- (બ) માંગની વિજ્ઞાપન સાપેક્ષતા ખ્યાલ સમજાવો. (07)**
- પ્ર. 3 સમતૃપ્તિ રેખાનો અર્થ આપી, તેની લાક્ષણિકતા અને મર્યાદાઓ વિષે વિગતે સમજાવો. (13)**
- અથવા**
- પ્ર. 3 (અ) કદવિક્રસના લાભાલાભ સમજાવો. (06)**
- (બ) ખર્ચ અંગેના વિવિધ ખ્યાલો સમજાવો. (07)**
- પ્ર. 4 ટૂંક નોંધો લખો. (કોઈ પણ બે) (14)**
1. પ્રો. જે. કે. મહેતાના આર્થિક વિચાર
 2. માંગની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલનું મહત્વ
 3. તૃષ્ટિગુણના પ્રકારો
 4. લાંબાગાળાના ખર્ચના વક્રની લાક્ષણિકતાઓ

ENGLISH VERSION

- Q. 1** **Answer the following question briefly. (Any five)** **(10)**
1. Give the definition of Economics by Adam Smith.
 2. What is microeconomics?
 3. What is a demand function?
 4. Mention the types of price elasticity.
 5. Explain the meaning of a budget line.
 6. State the limitations of marginal utility analysis.
 7. Define production.
- Q. 2** Explain the meaning of macroeconomics. Discuss in detail its scope, importance, and limitations. **(13)**
- OR**
- Q. 2 (A)** Explain the concept of price elasticity of demand. **(06)**
- (B)** Explain the concept of advertising elasticity of demand. **(07)**
- Q. 3** Define the indifference curve. Explain its characteristics and limitations in detail. **(13)**
- OR**
- Q. 3 (A)** Explain in detail the advantages and disadvantages of large-scale production. **(06)**
- (B)** Explain the various concepts of cost. **(07)**
- Q. 4** **Write short notes. (Any two)** **(14)**
1. Economic thoughts of Prof. J. K. Mehta
 2. Importance of the concept of price elasticity of demand
 3. Types of utility
 4. Characteristics of long-run cost curves
-